



## WIRES & CABLES

AN ISO 9001:2015 CERTIFIED COMPANY

## JIGAR CABLES LIMITED

Registered & Corporate Office

Plot No. 164/14 & 15, Jamwadi GIDC - 2

Gondal - 360 311 Dist. Rajkot (Gujarat) INDIA

Tel : +91 2825 221422

Web : www.sigmacab.com

E-mail : info@sigmacab.com

CIN No. : L28999GJ2017PLC095651

December 04, 2020

To  
BSE Limited (SME Platform)  
P. J. Towers,  
Dalal Street,  
Mumbai – 400 001.

Dear Sir,

**Sub: Publication of Advertisement of Notice related to Extra-Ordinary General Meeting to be held through Video Conferencing (VC)/Other Audio Visual Means (OAVM)**

**Ref: Scrip Code: 540651 Security ID: JIGAR**

Respected Sir/Madam,

Please find enclosed Notice published by way of an advertisement in respect of Extra-Ordinary General Meeting (EGM), to be held through VC/OAVM on Saturday, January 02, 2021 at 04:00 P.M. w.r.t Circular No. 20/2020 dated May 05, 2020 issued by Ministry of Corporate Affairs (the MCA Circular) which was duly published in following newspaper:

THE ECONOMIC TIMES [English Newspaper] dated December 04, 2020

THE NAVGUJARAT SAMAY [Gujarati Newspaper] dated December 04, 2020


The copy of advertisement published is enclosed for your reference.

Kindly consider the same and take on record.

Thanking You.

For, JIGAR CABLES LIMITED

*Priyanka Marvania*



CS Priyanka K. Marvania  
Compliance Officer & Company Secretary  
Membership No.: A58477

Encl: a/a





Companies & Economy 7

# Cos Wary of Sebi Order on Disclosing Forensic Probes

Rush to auditors, forensic investigators and lawyers to ring fence mandatory disclosures

Sachin.Dave@timesgroup.com

**Mumbai:** In July this year one of the largest listed companies in the information technology space received a whistleblowers letter. The letter had a wide range of accusations, ranging from some senior executives taking kickbacks and fudging the accounts. The company had roped in a forensic investigator to verify the allegations.

Nothing came out in an interim forensic report. The company was worried it would happen if they have to share such investigations with the public.

This is one of the biggest worries not for the IT company but even for large listed companies who at any given point in time have several ongoing investigations.

The worry is a result of an order by the capital market regulator, Securities and Exchange Board of India (Sebi). In the order Sebi has asked listed companies to disclose initiation of any forensic report - even by any other name - to stock exchanges.

Industry trackers say that disclosing such information would only result in chaos. Companies are rushing to their auditor, forensic investigators and lawyers to figure out a way around this. Companies are apprehensive about sharing each and every forensic investigation they conduct every year. Many fear that disclosing such details would only impact their stock prices.

Experts say that while more disclosures results in higher transparency, requirement to disclose every possible internal or external report initiated to address misstatement in financial statements could be onerous and may even cause confusion to the readers.

"Such reviews may end up covering even the routine internal audits, diligences, reviews to correct immaterial accounting practices, regularly undertaken by the corporates. The disclosure could be more helpful and the requirement less burdensome. If it is aimed at disclosing concluded audit reports which resulted in material adverse findings," said Yogesh Sharma, deputy managing partner, BDO India.

ET spoke to some of the CFOs, top auditors and forensic investigators. On an average top listed companies carry out at least 50 forensic investigations each year. Sebi had recently clarified

that only those investigations that impact the company's financials should be disclosed. The worry earlier was that even personal complaints around harassment or procurement frauds would have to be disclosed to the capital market.

"These clarifications address some of the concerns expressed by businesses in the area of matters to be disclosed, materiality and privacy. Yet, there is need for further clarity around reporting these activities at the onset, especially as many of them are carried out in private and management may need time to ascertain the findings and make informed decisions," said Nikhil Bedi, Partner and Leader, Forensic, Financial Advisory, Deloitte Touche Tohmatsu India LLP.

Many companies are also taking a legal opinion around which investigations can be kept out of the public eye. People in the know say that most companies do not want any of their ongoing investigations to be made public.

Companies are rushing to their forensic auditors and lawyers to figure out a way around this. Companies are apprehensive about sharing each and every forensic investigation they conduct every year. Many fear that disclosing such details would only impact their stock prices.

Experts say that while more disclosures results in higher transparency, requirement to disclose every possible internal or external report initiated to address misstatement in financial statements could be onerous and may even cause confusion to the readers.

"Such reviews may end up covering even the routine internal audits, diligences, reviews to correct immaterial accounting practices, regularly undertaken by the corporates. The disclosure could be more helpful and the requirement less burdensome. If it is aimed at disclosing concluded audit reports which resulted in material adverse findings," said Yogesh Sharma, deputy managing partner, BDO India.

ET spoke to some of the CFOs, top auditors and forensic investigators. On an average top listed companies carry out at least 50 forensic investigations each year. Sebi had recently clarified

# Australian Co Blocks ONGC Videsh Deal

**New Delhi:** In a setback to ONGC Videsh Ltd, Australia's Woodside Petroleum Ltd on Thursday said it has exercised its right to match an offer by the Indian company to buy FAR Ltd's stake in the \$4.2 billion Sangomar oil project in Senegal. OVL, the overseas investment arm of state-owned Oil and Natural Gas Corporation (ONGC), had last month reached a deal to buy Australian firm FAR Ltd's 13.67% stake in the Sangomar project off Senegal's shore for \$45 million. That deal was subject to a waiver of pre-emption rights by partners.

"Woodside has given notice exercising its right to pre-empt the sale by FAR Senegal RSSD SA (FAR) to ONGC Videsh Ventures Pvt Ltd (unit of OVL) of FAR's entire participating interest in the Rufisque, Sangomar and Sangomar Deep joint venture," the Australian company said. FAR has a 13.67% interest in the Sangomar exploitation area and a 15 per cent interest in the remaining RSSD evaluation area.

This would have been the first acquisition by OVL in two-and-a-half years. But with Woodside exercising the pre-emption rights, the deal is all but gone, a source with knowledge of the development said. Sangomar is a joint venture with Woodside Petroleum and Petrosen. - PTI

# Tribunal Orders Status Quo on Kochhars' Attached Properties

Raghav.Ohr@timesgroup.com

**New Delhi:** The Prevention of Money Laundering Act Appellate Tribunal on Thursday ordered status quo on the properties of former ICICI Bank managing director and CEO Chandra Kochhar and her husband. Opposing the demand, Aggarwal contended that ED need not obtain a "gag order" against Kochhars on what they would submit before a criminal court of law. He further averred that the appellate Tribunal lacks the jurisdiction to pass any directions in this regard.

The Tribunal chairman also orally questioned the ASC on how it could predict the line of argument(s) to be raised by the respondents (Kochhars) before a criminal court.

The Tribunal also asked ED to respond on the issue of maintainability of its appeal, which it will have to explain before February.

The ED's appeal has been admitted, the Chairman of the appellate Tribunal verbally informed both parties. A copy of the order has yet to be issued by the Tribunal.

Raju also demanded that an earlier order of ED's adjudicating authority be stayed till further orders.

The federal agency's adjudicating authority last month dismissed the attachment of properties belonging to Chandra Kochhar and her husband.

Opposing the demand, Aggarwal contended that ED need not obtain a "gag order" against Kochhars on what they would submit before a criminal court of law. He further averred that the appellate Tribunal lacks the jurisdiction to pass any directions in this regard.

The Tribunal chairman also orally questioned the ASC on how it could predict the line of argument(s) to be raised by the respondents (Kochhars) before a criminal court.

The Tribunal also asked ED to respond on the issue of maintainability of its appeal, which it will have to explain before February.

The ED's appeal has been admitted, the Chairman of the appellate Tribunal verbally informed both parties. A copy of the order has yet to be issued by the Tribunal.

Earlier, Aggarwal opposed ED's appeal on grounds of maintainability. Among the various grounds raised by him, Aggarwal argued that neither has the appeal been filed by the "appropriate authority" nor has a copy of the appeal been "deliberately" served to the Kochhars.

Elaborating, Aggarwal said that the email to which ED sent an intimation of appeal to Chandra Kochhar was incorrect.

Adjudicating authority order. In an 800-page order last month, the agency's adjudicating authority held that ICICI Bank's Rs 300-crore loan to Videcon International Electronics (VIEL) in September 2009 was never declared a non-performing asset and was in line with the bank's credit policy.

The order further held that the loan was repaid, and so there was no question of a loss and that Chandra Kochhar was just one of the members on the loan sanctioning committee and the decision to sanction loans could not have been taken by her individually.

**HDFC BANK** Department for Special Operations, 'Akanksha Complex', 4th Floor, Opp. J.K. Hero, 10-Vijay Plot Corner, Gondal Road Rajkot-360002.

**APPENDIX-IV [See Rule 8(1)] POSSESSION NOTICE (For Immovable Property)**

Whereas, The Undersigned being the Authorised Officer of the HDFC Bank Limited, under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002 (54 of 2002) and in exercise of power conferred under Section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, issued a Demand Notice dated 05/12/2019 calling upon the borrower & guarantors 1) Niten Devji Jungi 2) Trivenben Devjibhai Jungi 3) Devji Govindbhai Jungi to repay the amount mentioned in the notice being Rs.46,71,128.24 (Rupees Forty-Six Lakhs Seventy One Thousand One Hundred Twenty Eight & Twenty Four Paise Only) and interest thereon w.e.f. 01/12/2019 to gether with future interest and charge within 60 days from the date of receipt of the said notice.

The borrower having failed to repay the amount, notice is hereby given to the borrower/guarantors and public in general that the under signed has taken Symbolic Possession of the property described here in below in exercise of Power conferred on him under sub-section (4) of the said Act read with rule 8 of the Security Interest Enforcement Rules, 2002 on this 02-12-2020.

**Details of Immovable Property**

**Property No-1**  
Immovable Residential Property situated at "Shri Padmani Krupa", Paradise Area, City Sur Ward No. 3, Survey No. 3488-10, Paiki, Street of Abhabhai Hadaivi, Harshad Plot, Portbandar - 360 575 of state of Gujarat owned by Smt. Trivenben Devjibhai Jungi and Shri Devjibhai Govindbhai Jungi and bounded as under.

North	Other's Property
South	Road
East	Other's Property
West	Other's Property

**Property No-2**  
Immovable Residential Property situated at "Shri Padmani Krupa", Juri Bag, Street No. 5, City Survey Ward No. 3, Sur No. 3488-10, Paiki Part No. A, Paiki Part No. A & B, Kailash Gaunge, Paradise Road, Portbandar - 360 575 of state of Gujarat owned by Smt. Trivenben Devjibhai Jungi and Shri Devjibhai Govindbhai Jungi and bounded as under.

North	Plot No. 547
South	Part No. 1 of this Plot Paiki
East	Road
West	Property of Plot No. 609

(All of them herein after collectively referred to as "secured assets")  
The borrower & guarantors in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealing with the said property will be subject to the charge of the HDFC Bank Ltd. for an amount of Rs.46,71,128.24 (Rupees Forty-Six Lakhs Seventy One Thousand One Hundred Twenty Eight & Twenty Four Paise Only) as on 30.11.2019, and interest thereon from 01.12.2019 till the date of Realization. The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available to redeem the secured assets.

Date: 02/12/2020  
Place: Portbandar  
Sd/-  
Authorized Officer  
HDFC Bank Ltd.

**HDFC BANK** Department for Special Operations, 'Akanksha Complex', 4th Floor, Opp. J.K. Hero, 10-Vijay Plot Corner, Gondal Road Rajkot-360002.

**APPENDIX-IV [See Rule 8(1)] POSSESSION NOTICE (For Immovable Property)**

Whereas, The Undersigned being the Authorised Officer of the HDFC Bank Limited, under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002 (54 of 2002) and in exercise of power conferred under Section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, issued a Demand Notice dated 05/12/2019 calling upon the borrower & guarantors 1) Shiv Shakti Sea Food 2) Hirabhaji Jehabhaji Kudadi 3) Niten Devji Jungi 4) Trivenben Devjibhai Jungi 5) Devji Govindbhai Jungi to repay the amount mentioned in the notice being Rs.16,62,403.18 (Rupees Sixteen Lakhs Sixty Two Thousand Six Hundred Three and Sixteen Paise Only) and interest thereon w.e.f. 01/12/2019 to gether with future interest and charge within 60 days from the date of receipt of the said notice.

The borrower having failed to repay the amount, notice is hereby given to the borrower, guarantors and public in general that the under signed has taken Symbolic Possession of the property described here in below in exercise of Power conferred on him under sub-section (4) of the said Act read with rule 8 of the Security Interest Enforcement Rules, 2002 on this 02/12/2020.

**Details of Immovable Property**

**Property No-1**  
Immovable Residential Property situated at "Shri Padmani Krupa", Paradise Area, City Sur Ward No. 3, Survey No. 3488-10, Paiki, Street of Abhabhai Hadaivi, Harshad Plot, Portbandar - 360 575 of state of Gujarat owned by Smt. Trivenben Devjibhai Jungi and Shri Devjibhai Govindbhai Jungi and bounded as under.

North	Other's Property
South	Road
East	Other's Property
West	Other's Property

**Property No-2**  
Immovable Residential Property situated at "Shri Padmani Krupa", Juri Bag, Street No. 5, City Survey Ward No. 3, Sur No. 3488-10, Paiki Part No. A, Paiki Part No. A & B, Kailash Gaunge, Paradise Road, Portbandar - 360 575 of state of Gujarat owned by Smt. Trivenben Devjibhai Jungi and Shri Devjibhai Govindbhai Jungi and bounded as under.

North	Plot No. 547
South	Part No. 1 of this Plot Paiki
East	Road
West	Property of Plot No. 609

(All of them herein after collectively referred to as "secured assets")  
The borrower & guarantors in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealing with the said property will be subject to the charge of the HDFC Bank Ltd. for an amount of Rs.16,62,403.18 (Rupees Sixteen Lakhs Sixty Two Thousand Six Hundred Three and Sixteen Paise Only) as on 30.11.2019, and interest thereon from 01.12.2019 till the date of Realization. The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available to redeem the secured assets.

Date: 02/12/2020  
Place: Portbandar  
Sd/-  
Authorized Officer  
HDFC Bank Ltd.

**PSPL Punjab State Power Corporation Limited**  
Regd. Office : PSEB Head Office, The Mall Patiala - 147001.  
Corporate Identity Number U40109PB2010SG0033813  
Website : www.pspl.in  
E-Tender Enquiry No. 290/P-2/E-MP-W-11765 Dtd. 26.11.2020 & ID: 2020\_POWER\_56830\_1  
Scope of Work : Maintenance Of Switchyards And Transformer Yards Areas (22 Acres Approximately) At 2 X 650kw Micro Hydel Project And 4 X 210 Mw GGSSPT, Roopnagar.  
EMD : 1) The tenderer shall be required to submit earnest money Rs. 90,000/- (Rs. Ninety Thousand) online on website https://eproc.punjab.gov.in  
2) The co-operative societies were required to submit EMD as per notification no. 76/52/79-C-1(15)8556, Dated: 04.11.2019 which was valid up to 13.02.2024 issued by Co-operative department, Govt. of Punjab.  
Time period : As per NIT  
Date & time up to which tender shall be received : 05.01.2021, 11:00 AM  
Date & time of opening of tender : 12.01.2021, 11:30 AM  
Tender specifications can only be downloaded from the website https://eproc.punjab.gov.in/ & no hard copy of the same will be issued by this office.  
Note : 1. In case any difficulty regarding uploading of the tender the prospective bidders are requested to get clarifications from this office or M/s e-procurement system Government of Punjab. Contact No. +91-(172)-29702463. It is also requested to affix digital signature well in time so as to submit tenders through e-tendering only.  
2. It is informed that in case tender process is not completed due to any reason, no corrigendum will be published in newspapers. Details regarding corrigendum may be seen on website - https://eproc.punjab.gov.in.  
SEHQ GGSSPT, Roopnagar.

**FORM G INVITATION FOR EXPRESSION OF INTEREST**  
(Under Regulation 36A(1) of the Insolvency and Bankruptcy (Insolvent Resolution Process for Corporate Persons) Regulations, 2016)

**RELEVANT PARTICULARS**

1. Name of the corporate debtor	PAN INDIA INFRAPROJECTS PRIVATE LIMITED
2. Date of incorporation of corporate debtor	22/05/2007
3. Authority under which corporate debtor is incorporated/registered	ROC-Mumbai
4. Corporate identity number of corporate debtor	U82412MH2007PTC171016
5. Address of the registered office and principal office (if any) of corporate debtor	513/A, 5th Floor, Kohinoor City, Kirti Road, Narla (West), Mumbai-400070
6. Insolvency commencement date of corporate debtor	16 <sup>th</sup> July, 2020 (Information Received by RP on 23 <sup>rd</sup> July, 2020)
7. Date of invitation of expression of interest	4 <sup>th</sup> December, 2020
8. Eligibility for resolution applicants under section 25(2)(h) of the Code is available at:	Details can be sought by e-mailing cnp.pandina@gmail.com
9. Norms of ineligibility applicable under section 25A are available at:	Details can be sought by e-mailing cnp.pandina@gmail.com
10. Last date for receipt of expression of interest	13 <sup>th</sup> December, 2020
11. Date of issue of provisional list of prospective resolution applicants	29 <sup>th</sup> December, 2020
12. Last date for submission of objections to provisional list	4 <sup>th</sup> January, 2021
13. Date of issue of final list of prospective resolution applicants	13 <sup>th</sup> January, 2021
14. Date of issue of information memorandum, evaluation matrix and request for resolution plans to prospective resolution applicants	4 <sup>th</sup> January, 2021 (IM,IFRRP Document/Evaluation Matrix will be made available after executing confidentiality agreement)
15. Manner of obtaining request for resolution plan, evaluation matrix, information memorandum and further information	The prospective Resolution Applicants are requested to send e-mail to cnp.pandina@gmail.com
16. Last date for submission of resolution plans	2 <sup>nd</sup> February, 2021
17. Manner of submitting resolution plans to resolution professional	Soft copy of Resolution plan to be sent to cnp.pandina@gmail.com and hard copy to be sent in sealed envelope to RP at Nakshatra, 377, Gandhinagar, Nagpur-46
18. Estimated date for submission of resolution plan to the Adjudicating Authority for approval	1 <sup>st</sup> March, 2021
19. Name and registration number of the resolution professional	Ajay Vijaykumar Aggarwal, (BB/HPA-001/HP-000466/2017-18)10129
20. Name, Address and e-mail of the resolution professional, as registered with the Board	Ajay Vijaykumar Aggarwal, Nakshatra Insolvency Resolution Professionals Limited, Nakshatra, 377, Gandhinagar, Nagpur-460004 vijaykumar@aykoos.com
21. Address and e-mail to be used for correspondence with the resolution professional	Nakshatra Insolvency Resolution Professionals Limited, Nakshatra, 377, Gandhinagar, Nagpur-460004 cnp.pandina@gmail.com
22. Further details are available at or with	Details can be sought by e-mailing cnp.pandina@gmail.com
23. Date of publication of Form G	4 <sup>th</sup> December, 2020

Date: 03/12/2020  
Place: Nagpur  
Mr. Ajay Vijaykumar Aggarwal (BB/HPA-001/HP000466/2017-18)10129  
Resolution Professional  
For Pan India Infraprojects Private Limited

**THE TIMES OF INDIA INITIATIVE**

**Keep Learning**  
POWERED BY BYJU'S

**MANAGING SCREEN TIME TO MAXIMISE LEARNING**

Join our webinar on screen time and how to make the most of it.

**SATURDAY, 5<sup>TH</sup> DECEMBER, 2020**  
**5:00PM - 6:00PM**

TO REGISTER FOR THE WEBINAR, LOG ON TO [TIMESKEEPLEARNING.COM](https://timeskeeplearning.com). GIVE A MISSED CALL ON [955977000](tel:955977000), OR SCAN THE QR CODE.

**ANIL KUMAR** Principal, DPS Faridabad  
**DR. NAVIN SAKHUA** MD Ophthalmology, former AIIMS  
**DR. SAMEER MALHOTRA** Director and Head - Mental Health and Behavioral Sciences, Max Super Specialty Hospital, Saket  
**RAMESH KARRA** VP - Brand Strategy, BYJU'S

**THE TIMES OF INDIA**  
CHANGE Begins Here



